



## ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી

ગવર્નમેન્ટ પોલીટેકનીક કેમ્પસ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ, ખડીયા.

જુનાગઢ. ગુજરાત(ભારત) ફો.(ઓ) : ૦૨૮૫-૨૬૮૧૪૦૦

Website : <http://www.bknmu.edu.in> Email : [cebknmu@gmail.com](mailto:cebknmu@gmail.com)

પરીપત્ર:

વિષય: આગામી ડિસેમ્બર-૨૦૨૦ દરમિયાન લેવાનાર પરીક્ષાઓના પરીક્ષા કેન્દ્ર બદલવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કરવા બાબત.

સંદર્ભ: અત્રેની યુનિવર્સિટીનાં પરીપત્ર ક્રમાંક બીકેએનએમયુ/પરીક્ષા/૧૨૦૫/૨૦૨૦, તા.૨૮/૧૧/૨૦૨૦.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ભવનના અધ્યક્ષશ્રીઓ, યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક કેન્દ્રના પ્રોફેસર ઇન્ટ્યાજ્શ્રીઓ, યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજના આચાર્યશ્રીઓ, માન્ય સંસ્થાઓના વડાઓ તેમજ તમામ વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે Covid-19 વૈશ્વિક મહામારીને ધ્યાને લઈ વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં વિદ્યાર્થીઓ પોતાના રહેઠાણથી નજીકના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપી શકે તે માટે માન.કુલપતિશ્રીની આજ્ઞાનુસાર વિદ્યાર્થીઓના વિશાળ હિત ને ધ્યાને લઈ “Student Examination Center Choice” ઓનલાઇન પોર્ટલ તા.૦૩/૧૨/૨૦૨૦ થી તા.૦૫/૧૨/૨૦૨૦ રાત્રીનાં ૧૨:૦૦ વાગ્યા સુધી શરૂ કરવામાં આવશે તથા આ અંગેની માર્ગદર્શક સૂચનાઓ નીચે મુજબ છે.

### ઓનલાઇન પોર્ટલ અંગેની માર્ગદર્શક સૂચનાઓ:-

1. સૌપ્રથમ વિદ્યાર્થીઓએ <http://bknmu.gipl.net/StudentExamCenterChoice.aspx> લીંક પર ક્લિક કરતાં “Student Examination Center Choice” પર આવશ્યક વિગતો નીચે દર્શાવેલ સૂચના મુજબ ભરવાની રહેશે.
2. ત્યારબાદ Phase(તબક્કો) સીલેક્ટ કરવો. (પ્રથમ)
3. ત્યારબાદ જે-તે વિદ્યાશાખાઓની પરીક્ષા તથા સેમેસ્ટર પસંદ કરવા.
4. ત્યારબાદ એનરોલમેન્ટ નંબર એન્ટર કરવાનો રહેશે.
5. ત્યારબાદ Student Permanent ID એન્ટર કરવાનું રહેશે.
6. ત્યારબાદ વેલીડ ઇ-મેઇલ આઇ.ડી. એન્ટર કરવાનું રહેશે.
7. ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાનાં મોબાઇલ નંબર એન્ટર કરી “Send OTP” ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
8. વિદ્યાર્થીએ ડિસેમ્બર-૨૦૨૦ માં યોજનાર પરીક્ષા માટે પોતાનું પરીક્ષા કેન્દ્ર બદલવા માટે વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
9. ત્યારબાદ વિદ્યાર્થીએ ડ્રોપ-ડાઉન મેનુ માંથી પોતાની પસંદગીનું પરીક્ષા કેન્દ્ર સીલેક્ટ કરવું.
10. ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાનું મોબાઇલ નંબર સહીતનું હાલનું સરનામું ટાઇપ કરી પોતાનાં રહેઠાણનો દસ્તાવેજ (જો બંને બાજુ હોય તો મર્જ કરીને) અપલોડ કરવાનો રહેશે. જેવા કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણી કાર્ડ પૈકી કોઇપણ એક દસ્તાવેજ (JPG/JPEG/BMP/PDF ફોર્મેટમાં ફાઇલ 100kb થી 250kb સાઇઝ સુધીની મર્યાદામાં અપલોડ કરવાનો રહેશે.)
11. ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાનાં મોબાઇલ નંબર પર આવેલ OTP Enter કરી “Verify OTP” નામનાં મેનુ પર ક્લિક કરી Submit આપવાનું રહેશે.
12. એક વખત વિદ્યાર્થી દ્વારા પરીક્ષા કેન્દ્ર પસંદ કરી Submit આપ્યા બાદ વિદ્યાર્થીઓનાં પરીક્ષા કેન્દ્રમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.
13. જે વિદ્યાર્થીઓને ઓનલાઇન પોર્ટલમાં ક્વેરી હોય તો તે વિદ્યાર્થીઓએ [centerchoicebknmu@gmail.com](mailto:centerchoicebknmu@gmail.com) પર ઇ-મેલ દ્વારા જાણ કરવાની રહેશે.

|| તમસો મા જ્યોતિર્ગમય ||

*Dr. Khadee*  
પરીક્ષા નિયામક

બિડાણ: ઓનલાઇન પોર્ટલ અંગેનો સ્ક્રિનશોટ

ક્રમાંક/બીકેએનએમયુ/પરીક્ષા/૧૩૦૫/૨૦૨૦

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,

ગવર્નમેન્ટ પોલીટેકનીક કેમ્પસ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ,

ખડીયા, જુનાગઢ.

તા.૦૨/૧૨/૨૦૨૦

પ્રતિ,

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક ભવનના વડા તેમજ તમામ કોલેજોના આચાર્યશ્રીઓ, માન્ય સંસ્થાઓના વડાઓ તથા અનુસ્નાતક કેન્દ્રોના પ્રોફેસર ઇન્ટ્યાજ્શ્રીઓ તથા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો તરફ...

નકલ સાદર રવાના:-

(૧) માન.કુલપતિશ્રી/કુલસચિવશ્રીના અંગત સચિવશ્રી

નકલ રવાના જાણ તથા યોગ્ય કાર્યવાહી અર્થે:-

(૧) આઈ.ટી.સેલ. વેબસાઇટ પર પ્રસિદ્ધ થવા અને યોગ્ય કાર્યવાહી અર્થે.



## Student Examination Center Choice

\* Phase : --Select--

\* Exam : --Select--

\* Enrollment :

\* Student permanent ID :

\* Email ID :

\* Mobile No :

© ડિસેમ્બર ૨૦૨૦ માં યોજનાર પરીક્ષા માટે માડું ફાલનું પરીક્ષા કેન્દ્ર બદલવા ઈચ્છું છું.

\* Verify OTP :

નોંધ: ૧.યુનિવર્સિટી દ્વારા પ્રથમ અને દ્વિતીય તબક્કાની યાદી વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે.

૨. કોરોના વૈશ્વિક મહામારીની પરિસ્થિતીને ધ્યાને લઈ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનાં વિશાળ હિતમાં વિદ્યાર્થીઓનાં રહેઠાણનું ઉપરોક્ત પરીક્ષા કેન્દ્ર પૈકીનું નજીકનું પરીક્ષા કેન્દ્ર વિદ્યાર્થી પસંદ કરી શકશે જે માટે વિદ્યાર્થીએ ઓનલાઇન પોર્ટલ પર પોતાના રહેઠાણ પૂરાવા જેવા કે, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ અપલોડ કરીને પૂરાવો રજૂ કરવાનો રહેશે અને અપલોડ કરેલ ઓરીજનલ દસ્તાવેજ પરીક્ષા કેન્દ્ર પર રજૂ રાખવાનું રહેશે.

૩. જે કોઇ પરીક્ષા કેન્દ્ર પર નિયત સંખ્યાથી વધુ પરીક્ષાર્થીઓનું રજીસ્ટ્રેશન થશે તો યુનિવર્સિટી દ્વારા નજીકના અન્ય પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવાની વ્યવસ્થા કરવામાં આવશે જે તમામ વિદ્યાર્થીઓએ માન્ય રાખવાનું રહેશે. આ બાબતે આખરી નિર્ણય કરવાની સત્તા યુનિવર્સિટીની રહેશે.

